

આઈઆઈટી ગાંધીનગર ખાતે વિજ્ઞાન દિન ઉજવાયો

નવગુજરાત સમય > અમદાવાદ

પ્રવાહી નાઈટ્રોજન ભરેલી પ્લાસ્ટિકની બોટલ કેવી ધડાકા સાથે ફાટે છે અને ડોલમાંથી પિંગપોંગ બોલ કેવા ઉછળે છે, આવા સામાન્ય નિયમો પર આધારિત વિજ્ઞાનના પ્રયોગ જોઈને બાળકોના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો. આઈઆઈટી ગાંધીનગર ખાતે વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળા સહિત આવી કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. જેમાં વિવિધ શાળાઓના લગભગ ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અને રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનના

ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં આઈઆઈટીના વિદ્યાર્થીઓ દ્વારા ૫૦ સ્ટોલ ઉભા કરવામાં આવેલાં. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો માણ્યા હતાં. તે ઉપરાંત પીઆરએલ, વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર અને ગુજકોસ્ટે પણ સ્ટોલ રાખીને કેટલાક પ્રયોગો દર્શાવ્યા હતા. તે ઉપરાંત સાયન્સ ક્વિઝ, મેજીક શો, રોકેટ્રી વર્કશોપ, જેવી કેટલીક વર્કશોપ્સ પણ યોજાઈ હતી.

૫૦ વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાનમેળાની મુલાકાતે આવેલાં વસ્ત્રાલની શાળાના શિક્ષક દગંત પંડ્યાએ જણાવ્યું હતું કે, 'બાળકોના મનમાં વિજ્ઞાન માટે રસ જગાડવા તેમજ પ્રાથમિક નિયમો સ્પષ્ટ કરવા આ પ્રકારના આયોજનો જરૂરી છે.'